

B.Com. Semester - 2 (CBCS) Examination
March/April- 2019 (Old Course)
BUSINESS LAW-2
(DISC. SPE. ELE -1)

Time: 2:30 Hours**Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન-1 નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટની વ્યાખ્યા અને તેના આવશ્યક તત્વો સમજાવો. “વચન ચિઠ્ઠી” અને “વિનિમય પત્ર” ની વ્યાખ્યા આપો. બન્ને વચ્ચેનો તફાવત જણાવો. (20)
- અથવા
- પ્રશ્ન-1 (A) શેરોની વ્યાખ્યા આપો અને તેના પ્રકારો સમજાવો. (10)
- (B) વચન ચિઠ્ઠી સમજાવો. (10)
- પ્રશ્ન-2 સેબી એક્ટ-1992 અનુસાર, સેબી બોર્ડની સ્થાપના, બોર્ડનું સંચાલન, તેની સત્તાઓ અને કાર્યો સમજાવો. (20)
- અથવા
- પ્રશ્ન-2 સેબી એક્ટ-1992 અનુસાર નીચેના માટે કાનૂની સમજૂતી આપો. (20)
- [1] તપાસ-અન્વેષણ.
- [2] સિક્યોરીટી એપેલેટ ટ્રિબ્યુનલ.
- [3] નોંધણી પ્રમાણપત્ર.
- [4] સામૂહિક રોકાણ યોજના.
- પ્રશ્ન-3 ફેમા [FEMA]ની જોગવાઈઓ મુજબ RBIનાં કાર્યો જણાવો. (15)
- અથવા
- પ્રશ્ન-3 વિદેશી હૂંડિયામણ સંચાલન ધારો (FEMA)-2000નું મહત્વ અને હેતુઓ સમજાવો. (15)
- પ્રશ્ન-4 ટ્રેકનોંધ લખો. (કોઇપણ ત્રણ) (15)
- (1) હરિફાઇ અધિનિયમ-2002 મુજબ ડાયરેક્ટર જનરલની ફરજો.
- (2) જોડાણનું નિયમન.
- (3) ભારતનું હરિફાઇ આયોગ.
- (4) કોમ્પીટીશન એપેલેટ ટ્રિબ્યુનલ.
- (5) હરિફાઇ અધિનિયમ-2002નાં હેતુઓ.

ENGLISH VERSION

Que-1 Explain definition and its essential elements of Negotiable Instruments. Give definition of 'Promissory Notes' and 'Bill of Exchange'. State difference between both. (20)

OR

Que-1 (A) Give definition of Endorsements and state its types. (10)

Que-1 (B) Explain Promissory Note. (10)

Que-2 Explain establishment of SEBI board, management of board. Its powers and functions in accordance with SEBI Act-1992. (20)

OR

Que-2 Give legal explanation for following according to SEBI Act-1992. (20)

[1] Investigation.

[2] Security Appellate Tribunal.

[3] Registration Certificate.

[4] Collective Investment Scheme.

Que-3 State the functions of RBI as per provisions of FEMA. (15)

OR

Que-3 Explain importance and objectives of Foreign Exchange Management Act-2000. (15)

Que-4 Write short notes. (Any three) (15)

(1) Duties of Director General as per Competition Act-2002.

(2) Regulation of combination.

(3) Competition commission of India.

(4) Competition Appellate Tribunal.

(5) Objectives of competition Act-2002.
